

Date: 03rd july. 2021

To,
Bombay Stock Exchange Limited,
Corporate Compliance Department,
25<sup>th</sup> Floor, P. J. Towers, Dalal Street,
Mumbai – 400 001

Dear Sir,

Sub: Publications of Financial Results

Ref: Company Code: 531550, Company Name: Jhaveri Credits & Capital Ltd.

Pursuant to Clause 47 (1) (b) and 47 (3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we have pleasure to furnish herewith paper Clippings of audited Financial Results for the Fourth Quarter and Financial Year ended on 31.03.2021, Published in newspapers – Business Standard-English and Loksatta –Gujarati edition on 03.07.2021

The said paper clippings have also been uploaded on the website of the company

Kindly the take the note of the same Thanking You,

For Jhaveri Credits & Capital Ltd.

Kamlesh J. Jhaveri Whole Time Director

(DIN: 00266242)



JHAVERI CREDITS AND CAPITAL LTD.

CIN-L65910GJ1993PLC020371 · Regd. Office - 301 Payal Towers-II. Savaliguni, Vad

	Quarter Ended			(Rs. In Lacs Year Ended	
Particulars	(Audited)	31/12/2020 (Unaudited)	31/03/2020 (Audited)	31/03/2021 (Audited)	31/03/2020 (Audited)
Total Income from Operations	19.79	(0.85)	9.31	25.60	The second second
Net Profit/Loss before Tax & Exceptional Items	1.59	(2.06)	(2.49)		56.71
Net Prolit/Loss before Tax after Excentional Home	1.59	(2.06)	The second second	(0.50)	(24.58)
Nel Profit/Loss after Tax & Exceptional Items		-	(2.49)	(0.50)	(24.58)
Total Comprehensive Income	(37.22)	(2.06)	(3.44)	(39.31)	(25.54)
quity Share Capital	(37.22)	(2.06)	(3.44)	(39.31)	(25.54)
	646.33	646.33	646.33	546.33	THE RESERVE OF THE PERSON NAMED IN
arnings per share (of As, 10/- each) for continuing and discontinued operations)-Basic & Diluted	OTHER WILLIAM		U-10.00	040.33	646.33

Note: The above is an extract of the detailed format of quarterly/yearly Financial Results filed with the stock exchange under the stock exchange with the stock exchange under the stock exchange website viz www.bseindia.com

Date: 28.05.2021 Place: Vadedara

For Jhaveri Credits and Capital Ltd. SD. . Kamlesh J. Jhaveri, Wholetime Director (Oth:00266242)

Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial As

S. NO	(A)	Security Interest Act, 2002 (The Act)  Particulars of Mortgaged property/ (ies) (B)	Date Of NPA(C)	Outstanding Amount
1	LOAN ACCOUNT NO. HLAPAME00249509 1. GUJARAT MACHINERY PVT LTD 2. SUMAN KHAGENDR NATHGUHAROY 3. SUTAPA SUMAN GUHAROY	SHOP NO 18, GF DEV AURUM COMPLEX, OPP MADHUR HALL, 100FT ROAD, PRAHLADNAGAR, AHMEDABAD-380051, GUJARAT	26.05.202	(Rs.) (D)  Rs. 1,99,55,956.18 (Rupees One Crore Ninety Nine Lakh Fifty Five Thou- sand Nine Hundred Fifty Six And Palsa Eighteen Only) as
2	LOAN ACCOUNT NO. HLAPAME00290533 1. BHIKSHU METAL PVT. LTD. 2. AMIT KUMAR MONOHARI.AL SHAH 3. LALITA AMIT KUMAR SHAH	TENEMENT B-3, SHAHI RAJPATH CO- OPERATIVE HOUSING SOCIETY LTD., NEAR CIRCUIT HOUSE, CHANDANWADI CITY, SURVEY NO. 7237(OLD SURVEY NO. 184 & 194), TPS NO.14, FB NO.256, PLOT NO.9, 10, 11 & 12, GAYTRI TEMPLE TO GHODACAMP ROAD, MOUJE DARIYAPUR KAZIPUR, ASARVA	26.05.2021	on 26.05.2021 Rs. 1,98,50,745.10 (Rupees One Crore Ninety Eight Lakh Fifty Thousand Seven Hundred Forty Five And Paisa Ten Only) as
3	LOAN ACCOUNT NO. HHLAHE00220529 1. NIRMALYA DATTA 2. SUJAPA ALIAS SUJAPA DATTA	SHAHIBAUG, AHMEDABAD-380015, GUJARAT B-406, SWAREET APARTMENTS, SONAL CINEMA ROAD, OPP. SMORANA APARTMENTS, BAKERI CITY, VEJALPUR, AHMEDABAD-380051, GUJARAT		on 28.05.2021 Rs. 27,85,928.30 (Rupees Twenty Seven Lakh Eighty Five Thousand Nine Hundred Twenty Eight And Paisa Thirty Only)
	LOAN ACCOUNT NO. HHLAME00349901  1. RAWAL HIREN ARVIND  2. GAYATRI  c above named borrower(s) he	FLAT NO.G-305, SHREE NAND NAGAR-3, SONAL CINEMA ROAD, OPP. JAIN DERASAR, VEJALPUR, AHMEDABAD-380015, GUJARAT	31.03.2021	as on 31.03.2021 Rs. 15,03,536.74 Rsupees Fifteen Lakh Three Ihousand Five fundred Thirty Six and Paisa Seventy our Only) as on 11.03.2021

That the above named borrower(s) have failed to maintain the financial discipline towards their loan account (s) and as per books of accounts maintained in the ordinary course of business by the Company, Column D indicates the outstanding amount. Due to persistent default in repayment of the Loan amount on the part of the Borrower(s) the above said loan account has been classified by the Company as Non Performing Asset (as on date in Column C) within the guidelines refating to assets classification issued by Regulating Authority. Consequently, notices under Sec. 13(2) of the Act were also issued to each of the horrower.

In view of the above, the Company hereby calls upon the above named Borrower(s) to discharge in full his/their liabilities towards the Company by making the payment of the entire outstanding dues indicated in Column D above including up to date interest, costs, and charges within 60 days from the date of publication of this notice, failing which, the Company shall be entitled to take possession of the Mortgaged Property mentioned in Column B above and shall also take such other actions as

eliber to the possession of the Mortgaged Property memboned in Column B above and shall also take such other actions as available to the Company in law.

Please note that in terms of provisions of sub-Section (8) of Section 13 of the SARFAESI Act, "Aborrower can tender the entire publication of outstanding dues together with all costs, charges and expenses incurred by the Secured Creditor only till the date of publication of the notice for sale of the secured asset(s) by public auction, by inviting quotations, tender from public or by private time frame. Borrower may not be entitled to gettern the precent.

Sorti dis \Delta Canara I

🌃 सिक्किट Syndicate

POSSES!

(For Immovable property) [A Whereas: The undersigned being the Secunisation and Reconstruction of Final Act. 2002 and in exercise of powers contained to the Secunity Interest (Enforcement) Rules 2 2019 calling upon the borrowersurely to Yadav and Mrs. Savitaben Kanalitality to repay the amount mentioned in (Rupees Nine Lakhs Thirty Nin Fifty Three Only) is due along with the threen with further interest, costs, expendice / data of receipt of the said notice. The borrowersurely/owner of the property The borrowersurety/owner of the said notice. The borrowersurety/owner of the property power of the property borrow undersigned as per The Honourable Sur-CASE NO: 113219, dated: 05-FEBRUAN of the property owned by Mr. Kanaiyala'Ch described herein below in exercise of power leading to the said rule for the said rule

The owner of the property, borrower's and is hereby cauthoned not to deal with the po-subject to the charge of Contras Bank, Bagi (Rupees Nine Lakhs Thirty Nim Fifty Three Only) is due along with in with further Interest, costs, expenses etc. The borrower's attentron is invited to it of the SARFAESI Act. in respect of the

DESCRIPTION OF TH

All that part and parcel of Immovable Pro Palsana, Surat owned by Mr. Kaniyalai Ca Bounded as follows: East By Plot No. 62 South By Plot No. 72

PLACE

: 30-06-2021 : SURAT



### EIMCO ELE

CIN: L291 Regd. Office: Anand- Sojitra Roa

Ph: (02692) 23060 Email: investor@eimcoelecon

#### NOTICE ON INFORMATI GENERAL MEETING OF THE C VIDEO CONFERENCING/O

Notice is hereby given that the 47° members of the Company will be het p.m. (IST)through Video Conference ("OAVM"), in compliance with all the Act, 2013 and the Rules made then Board of India ("SEBI") (Listing Ob Regulations, 2015, read with 6 April 08, 2020, General Circular No. Circular No. 2012020 dated May 5, "dated 13" January, 2021 and other as dated 13° January, 2021and other as of Corporate Affairs ("MCA") and 1 2020/79 dated May 12, 2020 read CIR/P/2021/11 dated January 15 "relevant circulars"), to transact the the AGM. Members will be able t Members participating through the \ the purpose of quorum under Section In compliance with the relevant consisting of Notice of the AGM and statements for the financial year Auditors' Report and other documents sent to all the Members of the I



#### કોટનમાં ૬,૩૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,७૫,૧૨૫ ગાંસડીના સ્તરે ડેડીયાપાડાના પોમલાપાડા ગામમાં

## સોનાના ભાવમાં રૂ.૩૮૦ રૂા.૨૧.૬૯લાખનો દારૂ ઝડપાયો કરાર બે વ્યક્તિને પકડવાની પોલીસે કવાયત હાથ ઘરી દીમાં રૂ.૫૦૧નો ઉછાળો

મુંબઈ, તા. ર દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા. ઓપ્શન્સ પરાવાવય કામાડટા વાયદા, આપણન અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૦૯,૬૮૪ સોદાઓમાં કુલ ૨,૯,૧૯૦.૨૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૮૦ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૫૦૧ ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં

ક્રોટનમાં ૬,૩૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૭૫,૧૨૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટચા હતા, જ્યારે કપાસ, રબર અને સીપીઓમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી. મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો. મન્યા તવમાં નરમાઇના માહાલ હતા. ક્રિમતી ધાતુઓના સૂચકાંક બુલડેકસના જુલાઈ વાયદામાં ૮૭ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલાં કેક્સના જુલાઈ વાયદામાં ૯૯ પોઈન્ટની મૃત્રમેન્ટ રહી હતી. ક્રીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૪૭,૬૨૪ સાંદાઓમાં

કુલ રૂ.૩,૦૫૩.૪૭ કરોડનાં

કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં ૨,૪૭,૧૭૯ના ભાવે ખુલી, દિવસ દરિયાના ઉપયમ: ૨,૪૭,૪૦૫ અને નીચામાં ૨,૪૭,૧૩૯ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં ૨,૩૮૦ વર્ષી ૨,૪૦,૪૯ના ભાવે ૨,૩ ઘઈ ૨,૪૦ લપી ૨,૩૮,૦૧૬ અને ૨,૨૦૬ વપી ૨,૩૮,૦૧૬ અને મોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ ૨,૩૨ વથી ૨,૪,૮૯૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યાં હતો. ચાંદીના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ઓમાં ચાંદી જલાઈ વાયદો

સુધીમાં રૂ.૫૦૧ વધી રૂ.૬૮,૬૫૬ બોલાઈ રહ્યો હતો. એન્જી સેગમેન્ટમાં ૩૩,૬૩૬ સોદાઓમાં કુલ રૂ.૨,૩૪૩.૬૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૬૨૨ના ભાવે ખૂલી,દિવસ દરમિયાન ઉપરમાં 3.૫, દેજપ અને નીચામાં 3.૫, દ૧૨ રૂ.પ.૧૪૫ અને નાયામાં રૂ.પ.૧૧૧ મુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં ૧ બરલદીઠ રૂ.૧૨ વધી રૂ.પ.૧૧૯ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૦.૩૦ વધી રૂ.૨૭૨.૬૦ બોલાઈ

૧ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં રૂ.૬૮,૪૪૯ દિવસ દરમિયાન ૨,૬૨૮ સોદાઓમાં રૂ.૩૨૩.૬૩ ઉપરમાં રૂ.૬૮,૭૩૦ અને નીયામાં કરોડનાં કામકાજ થયા હતા. કપાસ રૂ.૬૮,૪૨૯ સુષી જુઈ, પ્રથમ સત્ર એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧,૨૯૯.૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૨૯૯.૫૦ અને નીચામાં રૂ.૧૨૯૦ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૧૧ વધી રૂ.૧,૨૯૬.૫૦ બોલાઈ રહૃાો હતો. આ સામે રબર જુલાઈ વાયદો ૧૦૦ કિલોદીઠ હુવાઇ પાવડા 100 કિલાઇઠિ કુ.૧૬,૮૦૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં ફુ.૧૬,૯૦૦ અને નીચામાં ફુ.૧૬,૬૨૫ સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૮ વધી ફુ.૧૬,૮૫૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

#### નેત્રંગમાં બોગસ તબીબ એક માસના સમયગાળામાં જ બીજી વખત જેલ ભેગો

નેત્રંગ, તા. ર નંત્રંગ, તા. ર રાજય સરકાર દ્વારા નકલી ડોકટર ઝડપી પાડવાની ચાલી રહેલ ઝુંબેશને લઈને નેત્રંગ ટાઉનમાં તેમજ પંથકમાં રાજકીય ગોડફાધરો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની છત્રછાયા નીચે કેટલાક વર્ષથી નેત્રંગ જેવા પછાત ત્રાલુકામાં વસતા અભણ ભોળા અભુધ આદિવાસી ભાઇ બહેનો તેમજ તેમના બાળકોના આરોગ્યની સુખાકારી સાથે ચેડા કરી રાતોરાત લાખોપતિ થવા નિકળી પડેલા

ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડવાની

ઝુંબેશ હાલમાં ચાલી રહી છે. ત્યારે નેત્રંગ પોલીસને મળેલ બાતમીના આધારે પી.એસ.આઇ. એન.જી. પંચાણી તેમજ સ્ટાફ દ્રારા બાતમીના

આધારે નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાંથી તા.03/0૬/૨૦૨૧ના રોજ નેત્રંગ માંડવી રોડ પર એક શોપીગ સેન્ટર આવેલ ''આશીર્વાદ ક્લિનિક'' તેમજ ટાઉનના સ્ટેશન વિસ્તારમાં પોતાના ટાઉનના સ્ટેશન વિસ્તારમાં પાતાના મકાનમાં દવાખાનાનું ચલાવતો. પિયુષ વિનોદભાઇ સરકાર (શર્મા) મુળ રહે પ્રક્રિમ બંગાળને ઝડપી લઇને ક્લિનિક ચલાવલ બાબતનું સરકાર તરારા કોઈ પરવાનગી લીધી છે, કે કેમ ડોક્ટર હોવાનું કોઈ સર્ટીકીફેટ છે, કે કેમ તે બાબતની સટાકાટ છે, કે કેમ તે બાબતના પુછતાજ કરતા કોઈ પણ જાત આધાર પુરાવો રજુ નહિ કરતા દવાઓના જથ્થા સાથે કુલ ૪,૯૪૪/-રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગો કરી દીધા હતો.

લગાવવામાં આવ્યા હતા, પરંતુ

ભરૂચ, તા. ર ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા તેમજ ગુનાઓમાં નાસતા કરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ એલ.સી.બી. પોલીસ સક્રિય બની હતી. જેમાં ભરૂચ લોકલ કાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમો કાર્યરત હતી તે દરમિયાન એલ.સી.બી. ટીમને મળેલ બાતમીને આધારે ભરૂચ શહેરએ ડિવેઝન પોલીસ ભારૂચ શહરુએ ડાવઝન પાલાત સ્ટેશનમાં પ્રોહી ગુનાના કામે સન ૨૦૧૯થી વોન્ટેડ આરોપી રાજવીર ઉર્ફે લાલુ મુકેશભાઈ પટેલ રહે, બીલીમોરા, નવસારીને બીલીમોરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

મગનભાઇ વસાવાની (મુળ રહેવાસી નિધટ હાલ રહે પોમલાપાડા) સાથે મળી પોમલાપાડા ગામની સીમમાં ડેડીયાપડા તરફથી અંક્લેશ્વર ત્રફ

જતા આવેલ કંચન પાંચા તડવીના

રતાં આવેલ કેવવે વાંચો તડવાંવા (રહેવાસી થપાવી નવી વસાહત) ખેતરમાં મનોજ મગનભાઇ વસાવાએ બુનાવેલ મકાનમાં મોટા

પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો સંતાડી રાખ્યો છે. આ ઇંગ્લીશ દારૂ મનોજ મગન વસાવા તથા ઉર્ફે ભુરીયો

ઉર્ફે રાજા ભરત આર્યએ ભેગા મળી મંગાવ્યો છે.અને મોડી રાતે

ઝડપાયો

રાજપાયળા, તા. ર ડેડીયાપાડા પોલિસ સબ ઈન્સ્પેક્ટર એચ.વી.તડવી ને બાતમી મળી હતી કે, ડેડીયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજ્ય ભરતે મનોજ

ગ્રાહકો સાથે તેઓ આ જથ્થો વેચાણ કરવાના છે.આ બાતમીને આધારે પોલિસ સબ ઇન્સ્પેક્ટર એશ વી તડવીએ પોમલાપાડા ગામની સીમ માંથી ROYAL BLACK ₹0,93,€00 २०७३६ नंश स्वाटरीया तथा

IMPERIAL BLUE ઉदेशान તા ૯૬,૦૦૦ રૂપિયાના મળી કુલ ૧૧,૬૯,૬૦૦ નો મુદા માલ પકડી પાડ્યો હતો.ભુરીયો ઉર્ફે રાજા ભરત, મનોજ મગન વસાવા ફરાર થઈ જતા એમને પકડી પાડવાના ચકો

#### ભરૂચનો નાસતો ફરતો અંકલેશ્વરના યુવક પાસે લગ્નની લાલચ આરોપી બીલીમોરાથી આપી રા.૧૩.૭૯ લાખ ખંખેરી લેવાયા

અંકલેષર,તા. ર અંકલેષર ના ગડખોલ પાટીયા પાસે નીમકાન નંબર ૧૫, સ્થામધામ બાદ યુવતીએ અમિતને તેણીની સોસાયટીમાં રહેતા અમિતકુમા નાતાબાયગ્રસ્તામ પંત્રી ગઈ છે અને બિસનુપદસામન્ત ઉ.વ. ૩૧ ના ઓ સાર્વાર માટે રૂપિયા જોઈએ છે ,તેમ બિસનુપદસામન્ત ઉ.વ.૩૧ ના ઓ એ લગ્ન માટે બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનુંએકાઉન્ટ એ લગ્ન માટે બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને રજી રેટ્રીશન કરાવુ હતુ, અને આ સાઈટ પર તેને સૂપ્રિયાતપના કુમાર નજ પુકાદ: રહેવાશી બદ્દ નગર , બેલી મ્યુ-સીપાલિટી વેસ્ટ બેગાળ સાથે પરિચય થયો હતો, અને યુવતીનો કોટો પસંદ પડતા અમિતકુમારે યુવતી સુપ્રીયાસાથે વાચવીત શરૂ કદી હતી, અને વાંટ્સએપ ઢારા વાતચીત નો દોર

સારવાર માટ ટ્રોપેયા જાઇએ છે ,તમ કહીને પ્રથમવાર ટ્રોપેયા પ૦૦૦ બેક ટ્રાન્સકર કરાવ્યા હતા,અને ત્યારબાદ ઓપરેશન માટે ૨૫૦૦૦ દ્રિપેયા બેક ખાતામાં ટ્રાન્સકર કરાવ્યા હતા. જોકે આ સિલસિલો યથાવત રહ્યોહતો. ભેજાબાજ યુવતીએ અમિત પાસે થી વીમા પ્રીમિયમ , મેડિક્સ પ્રાપ્ત થી વીમા પ્રીમિયમ , મેડિક્સ

સહિત ના બહાનાહેઠળ અંદાજીત કુલ રૂપિયા ૧૩,૭૯૦૦૦ પડાવી લીધા હતા.અને અમિત દ્વારા તેણીનેલગ્ન માટે પુછવામાં આવતા સુપ્રિયા એ બહાના કાઢવાનું શરુ કર્યુ હતુ.

ત્યારબાદ તેની આસપાસ પણ સુધી જરૂર ૫૦ લાખથી વધારે ડોઝ કરી ૨૦થી ૪૦ લાખની વચ્ચે વેક્સિન નથી થયું. કેટલાક દિવસ લાગ્યા, પરંતુ છેલ્લા ૩-૪ દિવસથી વેક્સિનેશન રોકાઈ ગયું છે.

### ભરૂચમાં પત્નીની હત્યા બાદ પતિનો મૃતદેહ તળાવમાંથી મળતાં ચકચાર

ભરૂચ, તા. ર ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક વિસ્તારમાં આવેલ મહાવીર નગર ઝૂંપડપ્લીમાં લોડા સમય પૂર્વ જ ઓટોરિશા ચાલક રિકાક્ત સૈયદ અને નજમા રિકાક્ત સૈયદ નામની ૩૨ વર્ષીય પરિણત મહિલા રહેવા આપણ હતાં સ્ત્રી કહેવા અવ્યા હતા. ગત બુધવારે રાત્રીના સમયે પતિ પત્ની બંને સુઈ રહ્યા હતા તે દૂરમિયાન રફક્ત સૈયદે તેની પત્નીને પાવડાના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હોવાની ચર્ચાઓ ચાલી હતી. જેમાં નજમાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને આડા

વજાત Re... નવજોત સિંહ સિદ્ધને પંજાબમાં કેમ્પોઈનિંગ કમિટીના ચીકનું પદ આપવા માંગે છે. પરંતુ સિદ્ધ હાઈકમાનની આ ઓકરથી ખુશ

નથા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ગુરુવારે કોંગ્રેસના હિન્દુ ભાઈચારાના તેના બો સ્ત્ર થે ૪ કલાક ચંડીગઢમાં બેઠક કરી. આ દરસ્થાન હિન્દુ ભાઈસ્ત્રાસન

કલાક ચડાગઢમાં બઠક કરા. આ દરમિયાન હિન્દુ ભાઈચારાના નેતાઓએ સિદ્ધ અંગે સીએમ સામે

પોતાની વાત રજુ કરી. જેમાં ત્રણ મુખ્ય વાતો હતી. ૧. પંજાબ પ્રદેશ કાંગ્રેસ કમિટી (PPCC) ચીક

હિન્દુ ભાઈચારાના નેતા હોવા જોઈએ. ર સિંહુને PPCC ના ચીફ તરીકે સ્વીકારવામાં નહીં આવે. ૩. હાઈકમાને પંજાબના શહેરી વોટરને

ધ્યાનમાં રાખવા જોઈએ. હાઈકમાને સીએમ કેપ્ટન અમરિન્દર સિંહને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી સીએમએ પીસી કરી નથી. આ બધા વચ્ચે એવી અટકળો થઈ રહી છે કે

અમરિન્દર સિંહ એકવાર કરીથી

દિલ્હી આવી શકે છે અને કોંગ્રેસ

હાઈકમાન સાથે તેમની મુલાકાત થઈ શકે છે. અકાલી દળના નેતા મહેશ ઈન્દર સિંહ ગ્રેવાલે નવજોત સિંહ સિંહુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પંજાબ બરબાદ થઈ રહ્યું છે અને કોંગ્રેસ

પોતાની સીટ બચાવવામાં લાગી છે પંજાબ સરકાર…

પેજાબ સરકાર... પણ હવે ખુદ સિધ્ધુની જ આ માનલે પોલ ખુલી રહી છે. સિધ્ધુએ કહ્યુ હતુ કે, પંજાબ ૪.૫૪ રૂપિયા પ્રતિ યુનિટે વીજળી ખરીદે છે જ્યારે દેશમાં એવરેજ કિંમત પ્રતિ

યુનિટ ૩.૮૫ રૂપિયા છે. પંજાબે પ્રાઈવેટ કંપનીના ત્રણ થર્મલ પ્લાન્ટ પર આધાર રાખવો પડે છે. તેમની પાસેથી પંજાબને વધારે ભાવે વીજળી પાતવા વજાવન વચાર ખાવ વાજગા ખરીદવી પડે છે.તેમણે કહ્યુ હતુ કે, બાદલ સરકારના સમયથી વીજળી ખરીદવાના કરારમાં ખોટી શરત દાખલ થઈ છે અને તેના કારણે ગયા અન્ય લઇ છે અને તેના કારણ ગયા વર્ષ સુધી પંજાબ સરકારને પ૪ હજાર કરોડ રૂપિયા ચુકવવા પડ્યા છે. કૃષ્<del>યિના...</del> કૃષ્યિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે

સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે, "પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારના "પૂર્વ કૃાય મતા લુડું નુના વલણનું સ્વાગત યોગ્ય છે. તેમણે પોતાના વલણથી સ્પષ્ટ કરી દીધું પોતાના વલેબથા સ્પષ્ટ કરા દાવુ છે કે કાયદાઓની બદલવાની કોઈ જરૂર નથી. જે બિંદુઓ પર વાંધો છે, તેને વિચાર-વિમર્શ બાદ

ધ્યાનમાં રાખવા જોઈએ.



સંબંધના વહેમમાં તેની હત્યા કરી દીધી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. હોવાની લાકચચાએ જાર પકડ્યુ છ. જોકે પત્નીના મૃતદેહ બાદ ગતરોજ છ. નજીકમાં આવેલ તળાવના પાણીમાં જ પતિ રફક્ત સૈયદનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. ત્રણ માસૂમ દીકરીઓની છત્રછાયા રૂપી માં ભાષના મૃતદેહ મળી

આવતા દીકરીઓના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. મૃતદેહ મળી આવતા હત્યા ગુન્હાની શોધખોળ એ-ડિવિઝન પોલીસે આરંભી છે. ત્યારે ટુક સમયનો ગુસ્સો એક હસતા રમતા પરિવારને વેર વિખેર કરી નાખે તેનુ આ ઉદાહરણ છે.

છીએ કે મુદ્દોથી જલદી ઉકેલવામાં આદંશર...

રાહુલ ગાંધીના ટ્વીટ પર કેન્દ્રીય મંત્રી મુજાર અબ્બાસ નકવીએ કહ્યું કે, રાહુલ ગાંધી પાસે તથ્યોની કમી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીના ટ્વીટ પર

મારૂ જુનુ નામ ભીખીબહેન ડાહ્યાભાઇ પટેલ હતુ બદલીને નવુ નામ ભાનુબેન દિલીપભાઇ પટેલ રાખેલ છે.

છે. રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જલદીથી જલદી મોટી સંખ્યામાં રસીકરણ કરવું જોઇએ, જેથી ઓછા સમયમાં વધારે લોકોને વેક્સિન લાગે અને મારૂ જુનુ નામ કમાર નવિનચંદ્ર મોકણી નાર કુનું નાન મહેન્દ્રકુમાર નવિનચંદ્ર મોકણ હતું બદલીને નવુ નામ મહેન્દ્ર નવીનચંદ્ર મોકણી

રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની

વેક્સિન નીતિ પર પ્રશ્નો કરી રહ્યા

કક, નારાયણનગર સોસાયટી. ગોરવા, વડોદરા.

રાખેલ છે. ઇ-७, રઘુવીરનગર, ન્યુ સમા રોડ, વડોદરા



આંત્રણવાડી કેન્દ્રમાં નોંધાયેલા બાળકોને વિના મૂલ્યે ગણવેશ વિતરણ



ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા ૩ વર્ષ થી ! વર્ષનાં દરેક બાળકો (કુમાર અને કન્યા)ને આંગણવાડી કેન્દ્ર મારફતે બાળક દિઠ ર જોડી ગામવેશ સરકારશ્રી દ્વારા વિના મલ્યે વિતરણ માટે આપવામાં આવતા ફોઇ જેશી લાભાર્શીઓ એ ગણવેશ પેટે કોઇપણ પ્રકારની રકમ ચકવવાની રહેશે નહિ.

> કમિશનર - વ - સચિવ મહિલા અને બાળ વિશસ વિભાગ, ગાંધીનગર

માફલા ખગ ખાગ લાકાલ લાભાગ, ગાંધીનોગે રે કેમ ન સાંગ્રેગ કે અનુ માર્ગ અને પ સીએ (સીએએ) નંબર ૩ ક / એનસીએલડી / એએઘએમ / ૨૦૨૧ મેટાનિત રિસોર્ચ કન્લાડન્ટર આપ્લેટ લીચેટક .......એવ્લિકન્ટ કંપની છે.ડ્રીમ્યું કે કંપની કંપની એક્ટ, 2013ની લાબામાં; અને એકલાયી 200 થી 223 અને કંપની એક્ટ, 2013ની લાબામાં; અને એકલાયો અંદ લાગ્રેશના આપીટ લિપિક, કુલ અન્ય લાગુ મોગલાએની લાબામાં; અને એકલેલાઓ ઉપદાને આપીટ લિપિક, કુલ એન્ટ કે ટેકનોલી આપીટ લિપિક, ઓલ્સ વેસ્ટ આપીટ લિપિક, આવેલ મેટન આપીટ લિપિક, રાક્યાર્થ કર્મને આપીટ લિપિક, અને સ્વાર્થ સાથેટ લિપિક, અને સેમ્પ્ર લાપ્યાં કર્મનોલોજી આપીટ લિપિક, રાક્યાર્થ અંગ્રેને આપીટ લિપિક અને રેમિલન રિસોર્ચ કન્સરનારનાર આ. લી. (લીપ્યું કંપની) અને તેમના સંબંધિત વીચરેલલ્લો અને લેશકારો

મેદીમેલ સિરોલી કંબલ્લ્ડરના આપીટ (લિપિટ) હંમાની તમે ગાંધાણીએ કોલીસ્થા, 1956 ફેલ્મ સમાપિટ કંપાની, તેમાં તેની લાક્યુલ્ટરે ઓફિલ છે. 30/1902, સેપોલી ક્રાસ્થલામાં તેના, (ત્રી/ એલા પોલેપોલીપિટ) સેસ્ટર ક્રાસીકોર્ય, વાર્ટીલા - 300 077, યુજવાલ એપ્લિકન્દ કંપાની 8/દીવર્જક કંપાની ક્રિટિસન રિસોલી કંબસ્ટરન્ટ આપીટ (લિપિટનના સિલોલી કે ક્રિટિસને લેવલની સૂપના અને ગલેરાલ 

521	કલાસ ઓફ મિટિંગ	મિટિંગની તારીખ	સમય (IST) સવારે 11.00 કલાકે	
1	સિક્યોરઠ ક્રેડિટર્સ	05 ઓગષ્ટ 2021		
अववा व	થોજનાની નકલો, જોડાણ સાથે પ કીલ, ઠડકર અને પફવાની ઓ કાઈવે, અમદાવાદ 380054, ગુર	ફિસ, 71, <b>ન્યુ</b> લોર્ક ટાવર-1	એ, થલતેજ ક્રોસ રોઠ,	
22	And Bash Consumber	and a free and a forms of	Branch arrando Carrando	

ટ્રિબ્યુનલે મિટીંગો માટે અધ્યક્ષ તરીકે પ્રેક્ટિસિંગ કંપની સેકેટરી શ્રી એસ.

બદલવા જોઇએ. હું તેમના વલણનું સ્વાગત કરું છું. કેન્દ્ર તેમની વાતથી સહમત છે અને અમે ઇચ્છીએ

ક્રી એસ. સમદાની મીટીંગ ને નિયુક્ત ર

#### ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવ જાહેર નિવિદા નં.૧૪- સને-૨૦૨૦-૨૧

સુરક્ષા મળી શકે. યોગ દિવસના લગભગ ૯૦ લાખ વેક્સિન ડોઝ દિવસે દેશમાં એક જ દિવસમાં લગાવવામાં આવ્યા હતા, પરંત્

કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, લુણાવાડા જિલ્લો-ાફીસાગર-૩૮૯૨૩૦ ધ્વારા નીચેના ક્ષમો માટે ટેન્ડર ઓનલાઇન માંગવામાં આવે છે રેન્ડર આઇ.ડી.નં. ૪૬૯૭૩૬

(૧) કામનું નામ- કડાણા ભાગ-૧ જુદ્રા પા.પુ.ચોજનાના બે વર્ષના મ. અને નિ.ની કામગીરી (૨) ઉકત કામની અંદાજીત કિંમત રા.૧૨૧.૪૨ લાખ (૩) એજન્સીની પાત્રતા- ટેન્ડરમાં રામેલ જોગવાઇ મુંજબ રજાસ્ટ્રેશનની નકલ, જી.એસ.ટી. નંબર પાન કાર્ડ, ઇન્કમટેકા રીટર્ન-૨૦-૨૧. બેંક સોલ્વન્સીની નકલ ધરાવતાં કોવા જોઇએ (૪)ઓનલાઇન ટેન્ડર શરવાની છેલ્લી તારીખ.૧૬/૦૭/૧૦૨૧ રાખવામાં આવેલ છે.કામની વધુ વિગતો માટે કેન નં.૦૨૬૭૪૨૫૧૫૮૦ અને મો.૯૯૭૮૪૦૬૬૨૦ પર સંપર્ક સાંધવો. ટેન્ડરને મંજુર કે નામંજુર કરવાની સત્તા સક્ષમ અધિકારી પાસે

ઉકત કામગીરીના ઇ-ટેન્ડરો વેબસાઇટ http://g અને આ સાઇટ ઉપર ઓનલાઇન ભરવાના રહેશે. ટેનડર અંગેની વધ માહિતી ઉપરોક્ત વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.

ગ્રાપ્ય વિસ્તારની પીવાના પાણીની તકલીફ અંગે પાણી પુરવઠા બોર્ડની ટોલ ફ્રી ફેલ સાઇન નં."૧૯૧૬" ઉપર સંપર્ક કરવા વિનંતી છે

(માહિતી/ગોધરા/૩૦૩/૨૦૨૧)

### ફોર્મ નં. સીએએ. ૨ કલમ ૨૩૦ (૩) ને અનુસરીને અને નિયમ ૬ અને ७ સીએ (સીએએ) નંબર ૩૬ / એનસીએલટી / એએયએમ / ૨૦૨૧

....એપ્લિકન્ટ કંપની 1/ડીમર્જડ કંપન ટ્રાન્ફર કંપની અને / અથવા પરિણામ કંપન સોર્સ ઈન્ટરનેશનલ પ્રાઈપેટ લિમ્પિટેક

ટૂબમ કંપથી એક , 2013ની બાયતાનું પ્રેમ હોવા 30.0 થી 202 એક પોલી એક. 2013ની કંપમી એક, 2013ની બાયતાનું પ્રેમ હોવા 30.0 થી 202 એક પોલી એક. 2013ને અન્ય લાગુ ગેમેપાલામેની લાબતાનું પ્રસ્તે કેન્દ્રીઓને દિવસોને આપ પ્રાાપિટ લિવિટ, સ્ટેમ એક કે ટેસ્તોનોજી પ્રાપ્યાદ લિવિટ, સ્ટેમ્સ એક એક પોલી પ્રાપ્યાદ લિવિટ, સ્ટેમ્સ એક એક પ્રેમ્સ પ્રાપ્યાદ લિવિટ, સાંદર્ગ એક એક પોલી પ્રાપ્યાદ લિવિટ, સાંદર્ગ એક લિવિટ, સાંદર્ગ એક પોલી પ્રાપ્યાદ લિવિટ, અને પોલીમાં લિવિટ, અને મોર્ટમાં લિવિટ સ્ટેમ્સ માર્ટમાં લિવિટ સ્ટેમ્સ માર્ટમાં લિવિટ સ્ટેમ્સ માર્ટમાં લિવિટ સ્ટેમ્સ માર્ટમાં સ્ટેમ્સ સ્ટેમ્સ માર્ટમાં લિવિટ સ્ટેમ્સ માર્ટમાં સ્ટેમ્સ સ્ટ

અને એક્સેલ્સોનો ર્વાઇન્ટરેલામાં પ્રાપિટ દિવિપેટ કંપનીના ને ગોળવાદમો અદિતિમા, ૧૭૦ ફેલ્લ ૩૦/૧/૩૦; સંપતિ કુલ સરદાદમાં લેલ, લો/એ વાંગ્ને સોર્પિટ સેટ કેસોર્ક, લોટલ ૧૭૦ ૦૦7, ગુજરાત કુલ્લ ફેલ્સ એ (વેલક્ટ કંપની ૧/ કોસોર્ક, લોટલ ૧૭૦ ૦૦7, ગુજરાત કુલ્લ ફેલ્સ એ (વેલક્ટ કંપની ૧/ કોસોર્ક, લોટલ ૧૭૦ ૦૦7, ગુજરાત કુલ્લ ફેલ્સ એ (વેલક્ટ કંપની ૧/ કોસોર્ક્સ સંદર્શનો ક્રમાં ક્રમાં લોટ દિવિપેટલ ક્રિક્સકોર્ટ ક્રિક્ટનર્ટ (ફ્રાફ્સકોર્ટ ને ક્રિક્સકોર્ટ ક્રમાં લોટલાઈ) અને કોસોર્ક્સ સંદર્શનો ક્રમાં ક્રમાં આવેલ ક્રિક્સકોર્ટ ક્રમાં ક્રમાં અને જોરદા ત્રીપા આવેલા ક્રમાં આવેલા ક્રમાં ક્રમાં ક્રમાં જોરદા સ્થાન અને જોરદા

સાલકિસાર્કિ કે કિટર્સ (સ્વાર્ટ્સિપ દોપાશાં) મો લિકાની ચૂધના અને ગરેકાં મોરા અલીલી આપના આવી છે 15 પૂત્ર અટ્ટાના ઓર્કેટ હાલ, મનાની પરિલક્ત પાંતી દ્રિન્યુલા, અલાવાદ લેંધ ("એનાની એવા.દી.") એ એક્સેવલોની ઇન્દરને બાલવા દર્શા પર વિદિર્ગતા સિલાકેટ કોઇનો અને અનિસ્તિક્તીઓ કિરોક્ટ ની અલગ દેવનો બાલવા કોઇ પર છે. ("અરપાટ કંપની 1/ (ટ્રાન્સર કંપની અને / અલવા પરિલામ કંપની"); એક્સેવલોની હે. ("અરપાટ કંપની 1/ (ટ્રાન્સર કંપની અને / અલવા પરિલામ કંપની"); એક્સેવલોની હે. વેડસ્ટ પા. શિ., ટેક્સીલી ક્રિન્ટ કંપની અને / અલવા પરિલામ કંપની"); એક્સેવલોની હે. વેડસ્ટ પા. શિ., ટેક્સીલી અને એસ્ટ પા. શિ., વર્ષા પ્રત્ને અનેલ લાકો ટેક્સીલોની હે. વેડસ્ટ પા. શિ., એક્સીલી મોરાને કલ્સનાદ આવશે. (ત્રીને કંપના) સ્વાર્ટ્સ કંપની અને પા. શિ., અને પેટર્સની મોરાને કલ્સનાદ આવશે. બ્રિપ્સ કંપની અને વિચારલા કરવા અને જે લોગ્ય લાગે, 'જૂરી આપી કીય, તો સુલાર કર્સ અલવા હતા કિ

54	કલાસ ઓફ મિટિંગ	મિટિંગની તારીખ	સમય (IST)
1	शिक्ष्योरङ हेडिटर्स	05 ऒসখ্ট 2021	सपारे 11.30 हलारे
2	અનસિક્યોર્ડ ક્રેડિટર્સ	05 ઓગષ્ટ 2021	સવારે 12.00 કલાદે

ુ----ત ત્વપદના અરજદાર કંપની ક્કર અને પહુવાની એફિસ, 71, ન્યુ ચોર્ક ટાવર-એ, ભાદાયાદ 380054, ગુજરાત થી બધા કામકાજના દિવસોગ માન અને બેઠકની તારીખ સંદિત (૨૧૧ અને રવિધાર ઝિલ્લ

# JHAVERI CREDITS AND CAPITAL LTD. CIN-L65910GJ1993PLC020371 • Read, Office - 301 Payal Taware-II Security Made We Engel On 31st March, 2027 (Rs. In Lass) Quarter Ended Year Ended 3109,2021 3147,2020 3149,2021 3149,2021 3149,2021 3149,2021 3149,2021 3149,2021 3149,2021 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3249,2022 3249,2022 3149,2022 3249,2022 3149,2022 3249,2022 3149,2022 3249,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022 3149,2022</td

🏿 🎮 पंजाब नैशनल बैंक 🖳 punjabnational bank **કબજા અંગેની નોટિસ** - (For immovable property) થી નીચે સહી કરનાર પંજાબ **નેશનલ** બેંક, ના અધિકૃત અધિકારીએ સિક્સ્મીટિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન એક ફાય સેટસ એન્ડ એન્કોરમિન્ટ ઓક સિક્સોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો એક્ટ નં. ૫૪) ની ધારા ૧૩(૧૨) સાથે વંધ

ારાગાળ માત્ર લાં કારળ તાં તે જો લાંગા ક કરવાદાં / ખાનીનદારં / ગોરોકર્તા આ રક્ષ્ય યુક્યવામાં અસ્કાલ ગરેલ છે, આથી કરજદારં / ખાનીનદારે / ગોરોકર્તા અને જો પ્રયાલયમાં આવે છે કે તાં. ૭૧.૦૭.૨૭૨૧ ના રોજ ઉપરોક્ત નિયમોનાં અંતર્ગત નિયમ ૮ ના ઘારા ૧૩(૧) ના અં સ્ટાસાર કરેલ પ્રવિકારીએ પોતાના અધિકારથી નીચે દર્શાવેલ મિલકરાનો કબ્ના મેં ગેળવેલ છે. મિલતના માર્લિક અને મેટેર બનતા સંખ્યામાં થીતે અર્થીથી વહેલા આપતાની કે નીચે દર્શાવેલ મિલકરો અંગે શોઈ વ્ય નહીં અને ભિલતો અંગે શોઈપણ વ્યવદાર પંખબ મેશનલ બેંક ની નીચે દર્શાવેલ બાદ્યાં રક્ષ્ય અને યકત વ્યાજ તથા ખર્ચા ર સ્થત મહુલામાં વર્શે પૂર્ણ તેમને ક્યાલિ કર્યું

રકમન વધુંચાવત્યા સુધા બાજન આધાન રક્ષ્યા. ગોરિર રોપલે અરક્ષ્યાનને આપેલા સ્થયમાં છોડાવવા અંગે કરજદારો/જામીનદારો/ગીરોદારોનું કાયદાના સેક્શન ૧૩ ના સબ્દ સેક્શન (૮) ની જોગવાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે.				
એ. નં.	કરજદારો/જામીનદારો/ ગીરોદારો નું નામ અને શાખા	ડીમાનક નોટીસ ની તારીખ અને બાકી રકમ	મિલકતોની વિગતો	
1.	મે. ત્રી મિરા કિપ્ના (માલિકા મુકેશ જેઠાનાડ ગોકલાશી) અને ત્રીમતી રોમાબેન મુકેશભાઇ ગોકલાશી (જાગીનદાર) (શાખા:વકોદરા-03/2320)	કીમાન્ક નોટીસ તા: ૧૫.૦૪.૨૦૨૧ રૂા. ૧૩,૦૯,૮૮૭.૫૫ (તા. ૧૪.૦૪.૨૦૨૧ સુધીના વ્યાજ સાથે બોજાને આધીન)	સામારા દરેશાંક ઘર — ભૂગુરેના જીવતી વહીદા સન્દ-ગુરુલોન વહીદા ગંભીના ત્રેમાં અને ગુમા, ગુદ, ડીમીએક તાં, અગુપી તો, તેમ જે જેમાં બંધામેલ છે તે સ્ત્રીમ સ્ટાર્શક એક કોમી મુખ સોમામારી તો નવોક તો. અગું તે તો, ગતો સ્ટેર્સીયા માત્ર માત્ર પ્રોશ્ય સીટ, ગુરુક્કે એકિસ સ્ત્રેમના ૧૦૦.સ પ્રોશ્ય મીટર, એક્સ્કેસ સેટીસા સ્ત્રેમના ૧૦,૨૨ ચોરસ મીટર મોટે સ્ત્રામ (૧૯૯૧ની માર્કિલી સીમતી સ્ત્રેમાનને મુખાવના ગ્રેમકાશાનીની છે. ગેની પાત્ર સીમા પૂર્વા લ્લોક તો. આઇ.ન. ૧,૫ પ્રક્રિયા ૧,૫ પ્રાપ્ટી કરોક, ઉત્તરા ૧,૦૦	
2.	શ્રી યોગેશકુમાર નટવરલાલ પટેલ (કરજદાર) અને શ્રીમતી ફેમાશીએન યોગેશકુમાર પટેલ (કો–કરજદાર) અને શ્રી ગૌતમ એન. પટેલ (જામીનદાર) (શાખા:વકોદરા-03/320)	ડીમાન્ડ નોટીસ તા: ૨७.૦૪.૨૦૨૧ રૂા. ૧૫,૯૩,૦૦૮.૬૯ (તા. ૨૬.૦૪.૨૦૨૧ સુધીના લ્યાજ સાથે બોજાને આધીન)	બિલકાનો તથામ ભાગ અને ફિસ્સો ઓવેલ છે તેના પ્રદુપ્યુંદેશના 500લો એક જ 500 લોકોદા તોને પાંત્રી કરો કરી, મોરે ગામ રહ્યા, રૂપીના નો દેવાનુ સાથે તેને આ કર્યા, રૂપીના નો દેવાનુ સાથે તેને કરા / ૧, પીત્રી લીદી શર્વે નં. પર, પ્રદી લીદી લાં તું પર, પ્રદુ તેને કરા / ૧, પાંત્રી લીદી શર્વે નં. પર, પ્રદે લીદી લાં લાં દ્વારા કરો જેક્શન 333પ ચારે જ્યારે પીદ, જેમાં બાંધાલે છે તે દેવાની પર દાઇલ કોને ''બીલીપાત્ર કોમ્પ્યોસ' 'કોમ લાં, લદે નં. ૧૦૧, તેમના કંપાયો લાંકોદા લાં કોમ લાં	
3.	મે. મેઠુલ એન્ટ્રરપાઇઝ (માલિક: જીગર દિનેશભાઇ મિસ્લી) અને નિમીયા જીગર મિસ્તી (હો–કરજદાર) અને શ્રી પ્રકાશ મરાઠે (જામીનદાર) (શાખા:વકોદશ-03૮3૨૦)	ડીમાનક નોટીસ તાઃ ૨७.૦૪,૨૦૨૧ રૂ. ૨૮,૧૫,૨૫૩.૦૦ (તા. ૧૭.૦૪,૨૦૨૧ સુધીના વ્યાજ સાથે બોજાને આધીન)	સ્થાયર મિલકતનો બ્લોક નં. ૪૯ જે "જ્ય શ્રી અંબિકા નિકેતન સોસાયટી" યુના આરીઓ પાછળ, વારસીયા, વહેદર, જમીનનો રેલ્બ્યુ સર્વે નં. ૩૭૦ એને ૩૩૫, દી. પ્રોક્ષી નં. યે, કાઇલબ પોટેન ને ૬૦ અને ૮, મોરે સ્થાદ, ૧૪૪ફેરમન જીત્લો વહેદરા, અલ-જીત્લો વહેદરા તેની ખલીકી શ્રી જીજ્ય દિસ્પાનાઇ વિજ્ઞીની છે. જેની ચતુનસીમાં પૂર્વ પ્લોટ નં. ૪૮, પર્ધિમાં દી.પી. રેક, ઉત્તર પ્લોય નં. ૧૦, દિભાર સોસાયટી રેક.	
4.	ત્રી વાયેલા નિખિલકુમાર મુકેશભાઇ (કરપ્રદાર) અને ત્રી વાયેલા દિપેષકુમાર મુકેશભાઇ (કો–કરપ્રદાર) (શાખાઇફરીયુરા - ૦૧૪૩૧૦)	ડીમાન્ડ નોદીસ તા: ૨૨.૦૪.૨૦૨૧ રૂા. ૩૫,૦૭,૭૯૯.૬૩ (તા. ૨૧.૦૪.૨૦૨૧ સુધીના ત્યાજ સાથે બોજાને આધીન)	મિલકાનો તમામ ભાગ અને દિલ્હાએ છે લાઇલ દુ-લેશન તે કર તો પહોર એવી સંસ્થાન ૧૦.૧૧ પોલર મીટલ અને લાઈ એવી ક્યાં પણ ૧૦ વાર્ટલ મીટલ અને કાઈ એવી પણ ૧૦.૦૧ પોલર મીટલ અને કાઈ એવી પણ ૧૦.૦૧ પોલર મીટલ અને ક.૩.૧૭ પોલર મીટલ અને ક.૩.૧૭ પોલર મીટલ અને કાઈ તે ક્યાં પ્રત્યા ૧૫ મોના કે પાસ્તા ૧૫ માના કર્યા ૧૫ માતા ૧૫ માતા કર્યા ૧૫	
5.	લી ઉપાધ્યા લીકાન્ત અને લીગતી સંગીતા લીકાન્ત ઉપાધ્યા (શાખા:દિવાલીપુરા - ૯૧૮૬૦૦)	ડીમાન્ડ નોટીસ તા: ૧૩.૦૪.૨૦૨૧ રૂા. ૨૩,૮૦,૨૦૨૧ (તા. ૧૨.૦૪.૨૦૨૧ સુધીના વ્યાજ સાથે બોજાને આધીન)	સ્થાવર સ્ટેશાંક ઘટ – મિલકત આવેલ છે તેનો સ્ટ્રુપ્ટ્રેશન ખુઠલો વહીદાર, ક્રોલન નં ડી/ઝર, એમલ રેલીકન્કલી, ક્રેલન દેલા નહતા સ્ટરન દિવાન નહતા સ્ટ્રેશન સ્ટ્રેશન કે તેના કરતા કરતા કરતા કરતા કરતા કરતા કરતા કે તેના કરતા કરતા કરતા કરતા કરતા કરતા કરતા કરત	

તા.: 01.09.૨૦૨૧ - સ્થળઃ વડોદરા નોંધઃ વિવાદની સ્થિતિમાં આ ન













રાશે. અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક